

પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫)

તા. ૯/૬/૨૫ : શાળાનું નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોં મીઠુ કરાવી ગીફ્ટ આપી વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું અને પ્રવેશોત્સવ ઉજવણી કરી.



તા. ૨૧/૬/૨૫ : વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સુક્ષ્મ પ્રાણાયામ તથા સૂર્યનમસ્કાર, ગૌમુખાસન, બાલાસન, પશ્ચિમોત્તાસન, વક્રાસન, ચક્રાસન, તાડાસન, ભુજંગાસન, વૃક્ષાસન જેવા આસનો કરાવી રોજીંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવી આસનો કરવા પ્રેરિત કર્યા.



તા. ૪,૭,૮/૭/૨૫ : વાલી મીટીંગ તબક્કાવાર ધો. ૧ થી ૫ ની વાલી મીટીંગો યોજાઈ. જેમાં વિદ્યાર્થીના અભ્યાસક્રમ સાથે વિવિધ સ્પર્ધા તથા પૌષ્ટિક આહાર અને શિસ્ત અંગે ચર્ચા થઈ.



તા. ૨૫/૭/૨૫ : તાલુકા કલા મહાકુંભ સ્પર્ધા માં ધો. ૧ થી ૫ ના ૨૦ વિદ્યાર્થીઓ તથા ચાર શિક્ષકોએ ભાગ લીધો.



તા. ૧૦/૭/૨૫ ગુરૂપૂર્ણિમા દિને વિદ્યાર્થીને ગુરુજીનું મહત્વ સમજાવ્યું સાથે ધો. ૫ ના વિદ્યાર્થી ફરસરામ જૈવલ એકલવ્યનું એક પાત્રિય અભિનય રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ગુરુજનોને પુષ્પ આપી આશિષ મેળવ્યા હતા.

